

B.A. Semester - 3 (CBCS) Examination
Oct/Nov - 2024 [As Per Syllabus Year June-2019]
ECO P6 Economics Theory of Money & Banking (Core)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ સમજાવી તેની મર્યાદાઓની વિગતે ચર્ચા કરો. (૧૪)
 અથવા
 પ્રશ્ન-૧ નાણું એટલે શું? નાણાંના પ્રાથમિક, સહાયક અને આનુષંગિક કાર્યો વિષે સમજૂતી આપો.
 પ્રશ્ન-૨ ભાવ સૂચક આંક એટલે શું? ભાવ સૂચક આંકની રચના સમજાવી તેમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરો. (૧૪)
 અથવા
 પ્રશ્ન-૨ ફિશરનો નાણાં પરિમાણનો સિદ્ધાંત સમજાવો.
 પ્રશ્ન-૩ પ્રો. પીગુનું રોકડ પુરાંતનું સમીકરણ સમજાવો. ફિશરના વિનિમય સમીકરણ કરતાં તે કેટલે અંશે ચઢિયાતું છે? (૧૪)
 અથવા
 પ્રશ્ન-૩ શાખ સર્જન એટલે શું? વેપારી બેંકોની શાખ સર્જન પ્રક્રિયા વિગતે સમજાવો.
 પ્રશ્ન-૪ વેપારી બેંકોનો અર્થ જણાવી તેના વિવિધ કાર્યોની વિગતે ચર્ચા કરો. (૧૪)
 અથવા
 પ્રશ્ન-૪ મધ્યસ્થ બેંકના પ્રણાલિકાગત અને વિકાસલક્ષી કાર્યોની ચર્ચા કરો.
 પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો (કોઈપણ બે) (૧૪)
 1. ભાવ સૂચક આંકનું મુલ્યાંકન
 2. વિનિમય સમીકરણની મર્યાદાઓ
 3. રોકડ પુરાંતના સિદ્ધાંતની મર્યાદાઓ
 4. વેપારી બેંકોની શાખ સર્જન પ્રક્રિયાની મર્યાદાઓ

ENGLISH VERSION

- Que.1 Define the meaning of Barter System. Explain the limitations of Barter System. (14)
 OR
 Que.1 What is Money? Explain primary, secondary and tertiary functions of money.
 Que.2 What is price Index number? Explain the construction of price index number and discuss the difficulties involved in it. (14)
 Que.2 Explain in detail the Quantity Theory of Money given by Fisher.
 Que.3 Explain the Cash Transaction Equation given by Pigou. How far it is superior than Fisher's Transaction Equation. (14)
 OR
 Que.3 What is Credit Creation? Explain the Credit Creation Process of Commercial Banks.
 Que.4 State the meaning of Commercial Bank, Explain the various function of Commercial bank. (14)
 OR
 Que.4 Explain in detail traditional and developmental functions of RBI.
 Que.5 Write short note (Any Two) (14)
 1. Evaluation of Price index number
 2. Limitations of Transaction Equation
 3. Limitations of Cash Transaction Theory
 4. Limitations of credit creation process of Commercial Banks
